

Seat No. : \_\_\_\_\_

## FS(R)-14

April-2007

Chemistry

Paper-II

(New Course)

Time : 3 Hours]

[Max. Marks : 70

સ્વીચ્છા : (૧) પ્રશ્નોના ટૂંકા અને મુદ્દાસર જવાબ આપો.

(૨) પ્રત્યેક પ્રશ્નના ૧૪ ગુણ છે.

(૩) પ્રશ્નની જમણી બાજુએ દર્શાવેલ અંક પેટા પ્રશ્નોના ગુણ દર્શાવે છે.

(૪) ઉત્તરવહીમાં પ્રશ્નોના સાચા કમ દર્શાવો.

પરમાણુ ભાર : H = 1, C = 12, O = 16, N = 14, S = 32, Cl = 35.5, Br = 80, Ag = 108,  
Pt = 195.

૧. (અ) કાર્બનિક સંયોજનમાં રહેલા નાઈટ્રોજનનું પરિમાપન કરવાની જેટાઇલની પદ્ધતિ સમજાવો. (૪)

અથવા

(અ) 0.6387 ગ્રામ મોનો એસિડીક કાર્બનિક બેઇઝના કલોરોપ્લેટિનેટનું દહન કરતાં 0.209 ગ્રામ ખેટિનમ મળે છે. તો બેઇઝનો અણુભાર શોધો.

(બ) ગમે તે બે ના જવાબ આપો. (૪)

(૧) કાર્બોનિયમ આયનોની સ્થિરતા સમજાવો.

(૨) SN<sup>2</sup> પ્રક્રિયાની કિયાવિધિ સમજાવો.

(૩) ઈલેક્ટ્રોન અનુરાગી એરોમેટીક વિસ્થાપન પ્રક્રિયા સમજાવો.

(૪) ઈલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયાની કિયાવિધિ ઉદાહણ આપી સમજાવો.

(ક) ગમે તે બે ના જવાબ લખો. (૪)

(૧) વ્યાખ્યા આપો : કિરાલીટી, ઈનેન્શિયોમર્સ અને ડાયાસ્ટ્રીયોમર્સ

(૨) n-બ્યુટેનના સંરૂપો દોરો અને તેમની સ્થિરતા ચર્ચો.

(૩) ટાઈરિક એસિડની પ્રકાશ સમઘટકતા સમજાવો.

(૪) R-S નામકરણના નિયમો લખો.

૨. (અ) ગમે તે ચાર ના જવાબ લખો. (૮)

(૧)  $C_5H_{11}Br$  અણુસૂત્ર ધરાવતા બધાજ શક્ય સમઘટકોના બંધારણીય સૂત્રો દોરો તેમજ IUPAC નામ આપો.

(૨) પ્રોપિનની  $Br_2$  અને પ્રોપાઈનની  $HBr$  સાથેની પ્રક્રિયાનું સમીકરણ આપો.

(૩) ડીહાઇડ્રેશન અને ડીહાઇડ્રોહોઝોજનેશન પ્રક્રિયાનો ઉપયોગ કરી ઈથિનના સંશોધણાની પ્રક્રિયાના સમીકરણ આપો.

(૪)  $C_2H_5Cl$  અને  $C_6H_5Cl$  વચ્ચેનો ભેદ દર્શાવતી પ્રક્રિયાઓ આપો.

(૫) બહુલીકરણ પર ટૂકનોંધ લખો.

(૬) આલ્કેન માટે બેયર કસોટીના સમીકરણો આપો.

(બ) ટૂકનોંધ લખો. (કોઈપણ બે) : (૫)

(૧) વુર્ટ્જ્યુ પ્રક્રિયા

(૨) આલ્કીનનું હાઇડ્રોબોરેશન ઓક્સિસેશન

(૩) ટર્મિનલ આલ્કાઈનની એસિડીકતા

(૪) માર્કોવનિકોફ નિયમ

૩. (અ) નીચેના સંયોજનોના બંધારણીય સૂત્રો દોરો (ગમે તે ચાર) (૨)

બ્યુટેનાલ, તૃતીયક બ્યુટાઈલ આલ્કોહોલ, ઈથેનેમાઈડ, ફેનિટોલ, સેલિસિલીક એસિડ, બ્યુટેનોન, કેટેચોલ.

(બ) નીચેના યુગ્મો વચ્ચે ભેદ દર્શાવતી એક રાસાયણિક કસોટી આપો. (ગમે તે બે) : (૩)

(૧) એસિટાલ્ડીહાઈડ અને બેન્જાલ્ડીહાઈડ

(૨) ઈથેનોલ અને ફિનોલ

(૩) 1-પ્રોપેનોલ અને 2-પ્રોપેનોલ

(ક) નીચેના પરિવર્તનો સમીકરણ આપી સમજાવો. (ગમે તે બે) (૪)

(૧) ફિનોલમાંથી સેલિસીલીક એસિડ.

(૨) પ્રોપિનમાંથી એસિટોન.

(૩) એસિટાલ્ડીહાઇડમાંથી લેક્ટીક એસિડ.

(૪) ડાય ઈથાઈલ ઈથરમાંથી એસિટાલ્ડીહાઇડ.

(૫) ટૂકનોંધ લખો. (ગમે તે બે) (૪)

(૧) કેનિજારો પ્રક્રિયા

(૨) હેલોઝોર્મ પ્રક્રિયા

(૩) કલેમનસન રિડક્શન

(૪) ફિનોલના ઉત્પાદનની કોઈ એક પ્રક્રિયા.

૪. (અ) નીચેનામાંથી એક પર નોંધ લખો. (૪)

(૧) એપિમરાઈઝેશન

(૨) ભુટારોટેશન

(બ) નોંધ લખો. (ગમે તે બે) (૪)

(૧) સ્ટ્રેકરનું સંશ્લેષણ

(૨) નીન હાઈફ્રીન પ્રક્રિયા

(૩) આઈસો ઈલેક્ટ્રીક બિંદુ

(ક) ગમે તે એક નો જવાબ આપો. (૪)

(૧) પેટાઈડના બંધારણમાં DNFBનો ઉપયોગ સમજાવો.

(૨) પ્રોટિનનું પ્રાથમિક બંધારણ સમજાવો.

૫. (અ) ઇલેક્ટ્રોન રચનાને આધારે લેન્થેનાઈડ્ઝની વિવિધ ઓક્સિડેશન સિથિતિઓ સમજાવો. (૭)

અથવા

(અ) લેન્થેનાઈડ સંકોચન એટલે શું ? લેન્થેનાઈડ સંકોચનની અસરો સમજાવો.

(બ) એક્ટિટનાઈડ તત્ત્વો વિવિધ રંગીન સંયોજનો આપે છે. તે ઇલેક્ટ્રોનીય બંધારણા સંદર્ભમાં સમજાવો. (૭)

અથવા

(બ) ટ્રાન્સ યુરેનિક તત્ત્વો એટલે શું ? ટ્રાન્સ યુરેનિક તત્ત્વોની બજાવટ સમજાવો.

---

Seat No. : \_\_\_\_\_

## FS(R)-14

April-2007  
Chemistry  
Paper-II  
(New Course)

Time : 3 Hours

[Max. Marks : 70]

- Instructions :**
- (1) Answer should be short and precise.
  - (2) Each question carries 14 marks.
  - (3) Figures to the right indicate marks of sub-question.
  - (4) Write the correct number of question in answer book.

Atomic weights : H = 1, C = 12, O = 16, N = 14, S = 32, Cl = 35.5, Br = 80, Ag = 108, Pt = 195.

1. (a) Explain the Kjeldahl's method for estimation of nitrogen in an organic compound. (4)

**OR**

- (a) 0.6387 gm of the chloroplatinate of a monoacidic organic base on ignition gave 0.209 gm. Platinum. Find out the molecular weight of the base.
  - (b) Answer any two : (5)
    - (1) Explain stability of carbonium ions.
    - (2) Explain reaction mechanism of  $\text{SN}^2$  reaction.
    - (3) Explain aromatic electrophilic substitution reaction.
    - (4) Explain with illustration : Electrophilic addition reaction.
  - (c) Answer any two : (5)
    - (1) Define : Chirality. Enantiomers and diasteriomers.
    - (2) Draw the conformations of n – Butane and discuss their stability.
    - (3) Discuss the optical isomers of tartaric acid.
    - (4) Write the rules of R-S nomenclature.
2. (a) Answer any four : (8)
- (1) Give IUPAC names and structural formula of all possible isomers of molecular formula  $\text{C}_5\text{H}_{11}\text{Br}$ .
  - (2) Give equation of the reaction of propene with  $\text{Br}_2$  and propyne with HBr.
  - (3) Give equation for the synthesis of ethene by dehydration and dehydrohalogenation reaction.
  - (4) Give distinguished test between  $\text{C}_2\text{H}_5\text{Cl}$  and  $\text{C}_6\text{H}_5\text{Cl}$ .
  - (5) Write note on Polymerisation.
  - (6) Give equation of Bayer's test for Alkene.

- (b) Write notes on (any **two**) : (6)
- (1) Wurtz reaction.
  - (2) Hydro boration oxidation of alkenes.
  - (3) Acidity of terminal alkyene.
  - (4) Marcovnicov's rule.
3. (a) Write the structural formula of following compounds (any **four**) : (2)
- Butanal, Ter-butyl alcohol, Ethanamide, Phenol, Salicylic-acid, Butanone, Catechol.
- (b) Give one distinguishing chemical test of the following pairs. (any **two**) : (3)
- (1) Acetaldehyde and Benzaldehyde.
  - (2) Ethanol and Phenol.
  - (3) 1-Propanol and 2-Propanol.
- (c) Explain any **two** of the following conversions giving equations. (4)
- (1) Salicylic acid from Phenol.
  - (2) Acetone from Propene.
  - (3) Lactic acid from Acetaldehyde.
  - (4) Acetaldehyde from Diethylether.
- (d) Write notes on following (any **two**) (5)
- (1) Canizarro's reaction.
  - (2) Haloform reaction.
  - (3) Clemmenson's reduction.
  - (4) Any one method for the manufacture of Phenol.
4. (a) Write a note on any **one** of the following : (4)
- (1) Epimerisation.
  - (2) Mutarotation.
- (b) Write notes on (any **two**) (5)
- (1) Strecker's Synthesis.
  - (2) Ninhydrin reaction.
  - (3) Isoelectric point.
- (c) Answer any **one** : (5)
- (1) Explain use of DNFB in the structure of peptides.
  - (2) Explain primary structure of Protene.

5. (a) Explain various oxidation states of Lanthanides on the basis of Electronic configuration. (7)

**OR**

- (a) What is Lanthanide contraction ? Explain the effect of Lanthanide contraction.
- (b) With reference to electronic configuration, explain that Actinide elements give different coloured compounds. (7)

**OR**

- (b) What are transuranic elements ? Explain preparation of transuranic elements.
-

Seat No. : \_\_\_\_\_

## FS(R)-14

April-2007

Chemistry

Paper-II

(Old Course)

Time : 3 Hours]

[Max. Marks : 70

સ્વીચ્છા : (૧) પ્રશ્નોના ટૂકા અને મુદ્દાસર જવાબ આપો.

(૨) પ્રત્યેક પ્રશ્નના ૧૪ ગુણ છે.

(૩) પ્રશ્નની જમણીબાજુએ દર્શાવેલ અંક પેટા પ્રશ્નોના ગુણ દર્શાવે છે.

(૪) ઉત્તરવહીમાં પ્રશ્નોના સાચા કમ દર્શાવો

પરમાણુભાર : H = 1, C = 12, N = 14, O = 16, Ag = 108, S = 32, Pt = 195, Cl = 35.5,  
Br = 80.

૧. (અ) કાર્ਬનિક એસિડનો અણુભાર શોધવાની સિલ્વરક્ષાર પદ્ધતિ ગણતરી સહિત સમજાવો. (૪)

અથવા

(અ) 0.257 ગ્રામ કાર્બનિક પદાર્થનું જેલાહ્લ પદ્ધતિથી પૃથ્વકરણ કરતાં જે  $\text{NH}_3$  નીકળે છે, તેનું તટસ્થીકરણ કરવા માટે 26.8 મિ.લિ. 0.1 N એસિડ વપરાય છે. તો પદાર્થમાં રહેલા નાઈટ્રોજનના ટકા ગણો.

(બ.) ગમે તે બે ના જવાબ આપો. (૫)

(i)  $1^\circ, 2^\circ, 3^\circ$  કાર્બોનિયમ આયનોની સ્થિરતાનો કમ સમજાવો.

(ii) કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયાની કિયાવિધિ સમજાવો.

(iii) બેન્જનની નાઈટ્રેશન પ્રક્રિયાની કિયાવિધિ સમજાવો.

(iv) ઉદાહરણ આપી સમજાવો.

(૧) ઈલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક

(૨) મુક્ત મુલક

(ક) ગમે તે બે ના જવાબ આપો. (૫)


(i) વ્યાખ્યાઓ આપો : (૧) કિરાલીટી (૨) ઈનેન્શીયોમર્સ અને ડાયાસ્ટીરીયોમર્સ

(ii) સંરૂપો એટલે શું ? n-બ્યુટેનના સંરૂપો દોરો તથા તેમની સ્થિરતા ચર્ચો.








(iii) R-S નામકરણના નિયમો લખો.

(iv) લેક્ટીક એસિડની પ્રકાશ સમઘટકતા ચર્ચો.

૨. (અ) નીચેના સંયોજનોના શક્ય સમઘટકોના બંધારણ દોરો અને નામ આપો. (૪)



(અ) નીચેની પ્રક્રિયાઓ પૂર્ણ કરી નીપજોના નામ આપો. (કોઈપણ પાંચ)



(ક) ટૂંકનોંધ લખો. (ગમે તે બ)

(૧) વુર્દુજ પ્રક્રિયા

(૨) આલ્કીનનું હાઇડ્રોબોરેશન ઓક્સિસેશન

(૩) બેયરની કસોટી

(૪) ગ્રિગનાર્ડ પ્રક્રિયક

3. (અ) નીચેના સંયોજનોના બંધારણીય સૂત્રો દોરો. (ગમે તે થાર) (૨)
- (૧) (i) P-કેસોલ
  - (ii) ૩-પેન્ટેનોન
  - (iii) એનીસોલ
  - (iv) ઈથાઈલ એસિટેટ
  - (v) મિથેનાલ
  - (vi) બેન્જાઈલ આલ્કોહોલ
- (૨) આલ્કોહોલ અને કિટોન વચ્ચે ભેદ દર્શાવતી કસોટી આપો. (૩)
- (બ) નીચેના પરિવર્તનો સમીકરણ આપી સમજાવો. (ગમે તે બે) (૪)
- (૧) મિથેનોલમાંથી ઈથેનોલ
  - (૨) એસિટીક એસિડમાંથી એસિટીક એનહાઇડ્રાઈડ
  - (૩) બેન્જનમાંથી ફિનોલ
  - (૪) ફિનોલમાંથી પીકીક ઓસિડ
- (ક) ટૂકનોંધ લખો. (ગમે તે બે) (૫)
- (૧) લુકાસ કસોટી
  - (૨) ઈપોક્સાઈડ
  - (૩) ૨૪તદર્પણ કસોટી
  - (૪) કેનિજારો પ્રક્રિયા
૪. (અ) નીચેનામાંથી એક પર નોંધ લખો. (૪)
- (૧) સૂકાતા તેલ
  - (૨) મીસેલીજ
- (બ) એમિનો એસિડ એટલે શું ? એમિનો એસિડના સંશ્લેષણની કોઈપણ બે રીતો સમજાવો. (૫)

#### **અથવા**

- (બ) “આઈસો ઈલેક્ટ્રીક બિંદુ” અને “ગ્રિવટ્ર આયન” ઉપર નોંધ લખો.
- (ક) પ્રોટીનનું બંધારણ સમજાવો. (૫)

#### **અથવા**

- (ક) “પોલીપેટાઈડ” ઉપર નોંધ લખો.

૫. (અ) કોઈપણ એક નો જવાબ લખો. (૭)

(૧) લેન્થેનાઈડ સંકોચન એટલે શું ? તેની અસરો સમજાવો.

(૨) લેન્થેનાઈડ શ્રેષ્ઠીના તત્ત્વોના નામ, સંજ્ઞા અને ઈલેક્ટ્રોનીય રચના આપો.

(બ) કોઈપણ એક નો જવાબ આપો. (૭)

(૧) એકટીનાઈડ શ્રેષ્ઠીના તત્ત્વોના નામ, સંજ્ઞા અને ઈલેક્ટ્રોનીય રચના આપો.

(૨) ટ્રાન્સ યુરેનિક તત્ત્વો એટલે શું ? ટ્રાન્સ યુરેનીક તત્ત્વોની બનાવટ સમજાવો.

---

**Seat No. :** \_\_\_\_\_

## **FS(R)-14**

**April-2007**

**Chemistry**

**Paper-II**

**(Old Course)**

**Time : 3 Hours]**

**[Max. Marks : 70**

**Instructions :** (1) Answer should be short and precise.

(2) Each question carries 14 marks.

(3) Figures to the right indicate marks of the sub-question.

(4) Write the correct number of question in answer book.

Atomic weights : H = 1, C = 12, N = 14, O = 16, Ag = 108, S = 32, Pt = 195, Cl = 35.5,  
Br = 80,

1. (a) Explain Silver Salt method with calculation for the determination of molecular weight of an organic acid. (4)

**OR**

- (a) In Kjeldahl's method 26.8 ml. 0.1 N acid is required to neutralize  $\text{NH}_3$  gas evolved from 0.257 gm. Organic compound. Calculate the percentage of nitrogen in an organic compound.


- (b) Answer any two : (5)

- (i) Explain the order of stability  $1^\circ, 2^\circ, 3^\circ$  of carbonium ions.  
(ii) Explain the reaction mechanism of nucleophilic addition reaction.  
(iii) Explain reaction mechanism of nitration reaction of benzene.  
(iv) Explain with illustration: Electrophilic reagent, free radical.








- (c) Answer any two : (5)

- (i) Define : (a) Chirality, (b) Enantiomers and diasteriomers.  
(ii) What is conformation ? Draw the conformers of n-butane and discuss their stability.  
(iii) Write the rules of R-S nomenclature.  
(iv) Discuss the optical isomerism of Lactic acid.

2. (a) Draw the structures of possible isomers and give their names of the following molecules. (4)



(b) Complete the following reactions and name the products (any five) : (5)



(c) Write short note (any two) : (5)

(1) Wurtz's reaction

(2) Hydroboration oxidation of alkene

(3) Bayer's test

(4) Grignard reagent

3. (a) Give structural formula of following compounds (any **four**) : (2)
- (I) (i) P-Cresol  
(ii) 3-Pantanone  
(iii) Anisole  
(iv) Ethyl acetate  
(v) Methanal  
(vi) Benzyl alcohol.
- (II) Give distinguish test between Aldehyde and Ketone. (3)
- (b) Explain following conversions with equation (any **two**) : (4)
- (i) Ethanol from methanol.  
(ii) Acetic anhydride from acetic acid.  
(iii) Phenol from benzene.  
(iv) Picric acid from phenol.
- (c) Write short note (any **two**) : (5)
- (1) Lucas test  
(2) Epoxide  
(3) Silver mirror test  
(4) Cannizaro reactions

4. (a) Write note (any **one**) : (4)
- (1) Drying oils.  
(2) Micelles.
- (b) What are amino acids ? Explain any two methods for synthesis of amino acids. (5)

**OR**

- (b) Write a note on “Isoelectric point” and “Zwitter ion”.  
(c) Explain the structure of Protein. (5)

**OR**

- (c) Write a note on “Polypeptides”.

5. (a) Answer any **one** : (7)

- (i) What is lanthanide contraction ? Explain the effects of lanthanide contraction.
- (ii) Write the names, symbols and electronic configuration of elements of lanthanide series.

(b) Answer any **one** : (7)

- (i) Write the names, symbols and electronic configuration of elements of actinide series.
  - (ii) What are transuranic elements ? Explain preparation of transuranic elements.
-